

Date: 11th August, 2022

The Manager
Listing Department
BSE Limited,
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street,
Mumbai-400 001
Fax: +91 22 2272 2082/3132
BSE Code: 533704



Essar Shipping Limited
Essar House
11 K.K.Marg
Mahalaxmi
Mumbai- 400 034

Corporate Identification Number
L61200GJ2010PLC060285
T + 91 22 6660 1100
F + 91 22 2354 4312
www.essar.com

The Manager
Bandra Kurla Complex
"Exchange Plaza"
National Stock Exchange of India Limited
Listing Department
Bandra (E)
Fax: +91 22 2659 8237/38
Mumbai - 400 051
NSE Code: ESSARSHPNG

The Manager
Bandra Kurla Complex
"Exchange Plaza"
National Stock Exchange of India Limited
Wholesale Debt Department
Bandra (E)
Fax: +91 22 2659 8237/38
Mumbai - 400 051
NSE Code: ESSARSHPNG

Sub: Newspaper Publication of Unaudited Financial Results for quarter ended 30th June, 2022.

Dear Sir/Madam,

As per the requirement of Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligation and Disclosure Requirements), enclosed herewith is the copy of the Newspaper Publication of Unaudited Financial Results (Standalone and Consolidated) for the quarter ended 30th June, 2022 published in Business Standard and Jai Hind on 11th August, 2022.

For Essar Shipping Limited

Nisha Barnwal
Company Secretary and Compliance Officer
ACS: A66804

Encl: A/a

Essar Shipping Limited

Registered Office: EBTSL Premises, ER-2 Building (Admn Bldg), Salaya, 44 KM, P.O. Box No.7, Taluka Khambalia, Devbhumi Dwarka,Gujarat-361305 T +91 2833 661444 F +91 2833661366
Email Id: esl.secretarial@essarshipping.co.in

BANNARI AMMAN SUGARS LIMITED
 Regd. Office :1212 Trichy Road, Coimbatore - 641 018, Tamilnadu.
 Phone : 0422 - 2204100, Fax : 0422 - 2309999, Web : www.bannari.com
 E-mail : shares@bannari.com, CIN : L15421TZ1983PLC001358

NOTICE OF 38th ANNUAL GENERAL MEETING AND E-VOTING

Notice is hereby given that the Thirty Eight Annual General Meeting of the Members of Bannari Amman Sugars Limited will be held on **Friday the 9th September 2022 at 4.45 P.M(IST)** through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM) to transact the business contained in the Notice dated 30th May, 2022 in accordance with the applicable provisions of the Companies Act, 2013 and Rules made there under read with Circulars issued by the Ministry of Corporate Affairs and SEBI (LODR) Regulations, 2015 read with circulars issued by the Securities and Exchange Board of India (SEBI).

The AGM Notice and the Annual Report for the year 2021-22 have been sent electronically on 9th August, 2022 to all the members whose e-Mail IDs are registered with the Company's Registrar & Transfer Agents (RTA), M/s Cameo Corporate Services Ltd or their Depository Participants. The AGM documents are also available on the websites of the Company (www.bannari.com), the stock exchanges viz., National Stock Exchange of India Limited (www.nseindia.com) and BSE Limited (www.bseindia.com). Please note that no physical/Hard copy of the Annual Report would be sent to the members. Detailed instructions to Members for registration of their email address, manner of participating in the 38th AGM through VC/OAVM including manner of e-voting is set out in the Notice of AGM.

Pursuant to Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of the SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations 2015, the Company is providing remote e-voting facility for transacting the businesses contained in the Notice. The remote e-voting period commences on **Monday, 5th September 2022 (9.00 A.M IST) and ends on Thursday, 8th September, 2022 (5.00 P.M IST)**. During this period, members of the Company, holding shares either in physical form or in dematerialised form as on 2nd September, 2022 (cut-off date) may cast their vote electronically. Thereafter, the e-voting module shall be disabled by CDLS.

A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date (2nd September, 2022) only shall be entitled to avail the facility of remote e-voting as well as voting in the General Meeting. E-voting is enabled to all the demat account holders by way of single login credential through their demat accounts/websites of Depositories / Depository Participants. Demat account Holders can cast their vote without having to register again with e-voting service providers (ESPs). Members holding shares in physical mode and who have not updated their e-mail address with company can obtain Notice of AGM, Annual Report and/or for joining the AGM through VC/OAVM facility including e-voting by sending scanned copy of (a) copy of signed request letter mentioning the folio number, name and address of the member (b) Self attested copy of the PAN Card and (c) self attested copy of Aadhaar/Driving License/Voter ID or Passport in support of the address of the member by email to agm@cameoindia.com. The voting rights of the Members shall be in proportion to their shareholding in the Company as on 2nd September, 2022 (cut-off date).

Pursuant to Finance Act 2020, dividend income will be taxable in the hands of shareholders w.e.f. April 1, 2020 and the Company is required to deduct tax at source from the dividend paid at the prescribed rates, if the dividend amount exceeds Rs.5,000/-. For the prescribed rates for various categories, the shareholders are requested to refer to the Finance Act, 2020 and amendments thereof.

A Resident individual shareholder with PAN and who is not liable to pay income tax can submit a yearly declaration in Form No. 15G/15H (which can be downloaded from the company's website www.bannari.com) to avail the benefit of non-deduction of tax at source and send the same by email to investor@cameoindia.com on or before 2nd September, 2022. Shareholders are requested to note that in case their PAN is not registered, tax will be deducted at a higher rate of 20%

In case of any queries or grievances pertaining to e-voting or attending the AGM through VC/OAVM, Members may write an e-mail to shares@bannari.com or Investor@cameoindia.com

Notice is also hereby given that the Register of Members and Shares Transfer Books of the company shall remain closed from 3rd September, 2022 to 9th September, 2022 (both days inclusive) in accordance with the provisions of Section 91 of the Companies Act, 2013 read with Regulations 42 of the SEBI (LODR) Regulations, 2015.

By order of the Board
For Bannari Amman Sugars Limited
C PALANISWAMY
 Company Secretary
 Coimbatore
 10.08.2022

RELIGARE FINVEST LIMITED
 Registered Office: First Floor, P-14, 45/90, P-Block, Connaught Place, New Delhi-110001
 Corporate Office: Max House, 7th Floor, Block A, Dr. Jha Marg, Okhla Phase-III, Okhla Industrial Estate, New Delhi 110020

POSSESSION NOTICE
Appendix IV rule 8 (1) of the SARFAESI Act

WHEREAS the undersigned being the Authorised Officer of **M/s. RELIGARE FINVEST LIMITED**, having its registered office at First Floor, P-14, 45/90, P-Block, Connaught Place New Delhi-110001, and having its corporate office at Max House, 7th Floor, Block A, Dr. Jha Marg, Okhla Phase-III, Okhla Industrial Estate, New Delhi 110020 under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) (hereinafter "SARFAESI Act") and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 07-01-2022 for Loan agreement/account no. **XMORSUR00070102 (Application ID 647800)** calling upon ("The Borrower/guarantor/mortgagor") of **JANISH TEXTILES THROUGH ITS PROPRIETOR** at 118-119, ROYAL IND. EST., DELAD PATIYA SAYAN ROAD, SURAT CITY, GUJARAT-394130. **VANSHIKA FABRICS THROUGH ITS PROPRIETOR** at 1-2, OSKAR, IND. EST., DELAD PATIYA SAYAN ROAD, SURAT CITY, GUJARAT-394130 **ALSO AT:** BLOCK NO.196, PLOT NO.17, GROUND FLOOR SHREE JAI RANCHOH ESTATE, DELAD TAL-OLPAD, DIST-SURAT GUJARAT-394130 **Also At** 118-119, ROYAL IND. EST. DELAD PATIYA SAYAN ROAD, SURAT-394130. **MEENABEN MUKESHCHANDRA DINA @ MINAXIBEN D/O NARANBHAI KANJIBHAI PATEL W/O MUKESHCHANDRA DINA, RINAL M DINA W/O MILIN MUKESHCHANDRA DINA, RAVI MUKESHCHANDRA DINA, KHUSHBU R DINA W/O RAVI MUKESHCHANDRA DINA & MILIN MUKESHCHANDRA DINA S/O MUKESHCHANDRA JAGMOHANDAS DINA all at** 5/B ASHWINI APT. OPP. SARDAR NAGAR SOC. KAPADIA COMPOUND SUMUL DAIRY ROAD CHORYASI SURAT SURAT, GUJARAT-395004 **Also At** 118-119, ROYAL IND. EST. DELAD PATIYA SAYAN ROAD SURAT, SURAT-394130. **VASUDEV FABRICS THROUGH ITS PARTNER** 135-136 ROYAL IND. EST. DELAD PATIYA SAYAN ROAD SURAT GUJARAT-394130 **Also At** 118-119, ROYAL IND. EST. DELAD PATIYA SAYAN ROAD SURAT, SURAT-394130, to repay the amount mentioned in the demand notice amounting to **Rs. 1,54,76,935.46/- (Rupees One Crore Fifty Four Lakh(s) Seventy Six Thousand Nine Hundred Thirty Five And Paise Forty Six Only)** as on **27-Dec-2021** together with interest and other contractual dues from **27-Dec-2021** within 60 days from the date of the said notice. ("The Borrower/guarantor/mortgagor") have failed to repay the said amount, notice is hereby given to the borrowers in particular and public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13 (4) of the said SARFAESI Act read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002, on this **9th day of August 2022**.

Under section 13 (8) of the Securitization Act, the borrowers can redeem the secured asset by payment of the entire outstanding including all costs, charges and expenses before publication of sale notice.

("The Borrower/guarantor/mortgagor") in particular and the public in general are hereby cautioned not to deal with the property & any dealings with the property will be subject to the charge of M/s Religare Finvest Limited, for an amount to **Rs.1,54,76,935.46/- (Rupees One Crore Fifty Four Lakh(s) Seventy Six Thousand Nine Hundred Thirty Five And Paise Forty Six Only)** as on **27-Dec-2021** together with interest and other contractual dues thereon respectively against loan agreement/account no. **XMORSUR00070102 (Application ID 647800)**.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
 ALL THAT PIECE AND PARCEL OF OLD TENOR LAND SITUATED IN STATE: GUJARAT, DISTRICT: SURAT, SUB-DISTRICT & TALUKA: OLPAD, MOJE: VILLAGE PARIYA BEARING KHATA NO. 367, REVENUE SURVEY NO. 497, BLOCK NO. 598/B ADMEASURING HECTARE-ARE 1-35-55 SQ. MTRS. AKARE RS. 20.70 PAISA. N.A. LAND PAIKEE, **BOUNDED AS UNDER** : EAST : BLOCK NOS. 589 & 597, WEST - BLOCK NO. 598/A, NORTH - BLOCK NOS. 597 & 599, SOUTH - BLOCK NO. 589
Place : Surat
Date : 09-08-2022
 Authorised Officer
 Religare Finvest Limited

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
 All that part and parcel of the property consisting of Flat No. 301, 3rd Floor, Shree Vatika Complex, FSI 500 Sq.Fts. R.S. No. 854, T.P. Scheme No. 3 F.P. No. 1006, City Survey No. 320, Block No. A-22, & A-23, Bapod, Vadodara, within the Registration Sub District and Dist Vadodara. In the name Shri Dhiman Ramkrishna Mehta. Bounded : East by : Main Road, West by : Flat No. 302, North by : Flat No. 305, South by : Main Road.
Date : 05.08.2022
Place : Vadodara
 Authorised Officer
 Canara Bank

EURO MULTIVISION LIMITED

CIN: L32300MH2004PLC145995
 Regd Office: F 12, Ground Floor, Sangam Arcade, Vallabhghai Road, Vile Parle (West), Mumbai-400056. India - Tel.: 022-40364036 Fax : 022-40364037
 E-mail : info@euromultivision.com, Website : www.euromultivision.com

Extract of Unaudited Financial Results for the Quarter Ended June 30, 2022
 (Rs. in Lakhs except EPS)

Particulars	Quarter Ended			Year Ended
	30-Jun-22 Unaudited	31-Mar-22 Audited	30-Jun-21 Unaudited	31-Mar-22 Audited
Total Income from operations (net)	0.10	-	0.10	0.10
Net Profit / (Loss) for the period (before tax, exceptional and / or extraordinary items)	(301.67)	(304.88)	(322.27)	(1238.86)
Net Profit / (Loss) for the period (before tax, (after exceptional and / or extraordinary items)	(619.39)	(304.88)	(322.27)	(1238.86)
Net Profit / (Loss) for the period (after tax, exceptional and / or extraordinary items)	(619.39)	(304.88)	(322.27)	(1238.86)
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and other Comprehensive Income (after tax)]	(619.39)	(304.88)	(309.59)	(1226.12)
Equity Share Capital	2380.00	2380.00	2380.00	2380.00
Other Equity (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of previous year				(38028.79)
Earnings Per Share (of Rs.10/- each) (For continuing and discontinued operations) (In Rs.)				
(a) Basic	(2.60)	(1.28)	(1.30)	(5.15)
(b) Diluted	(2.60)	(1.28)	(1.30)	(5.15)

Notes:
 1. The above is an extract of the detailed format of unaudited Financial Results for the quarter ended June 30, 2022 filed with the Stock Exchanges under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The detailed financial results and its extracts is available on website of the Stock Exchanges websites i.e. BSE Ltd. (www.bseindia.com), and National Stock Exchange of India Ltd. (www.nseindia.com) and website of the Company i.e. www.euromultivision.com.
 2. The detailed Financial Results and this Extract were reviewed by the Audit Committee and approved by the Board of Directors in their meeting held on Wednesday, August 10, 2022.

For Euro Multivision Limited
 Sd/-
Hitesh Shah
 Chairman and Whole Time Director
 DIN: 00043059

Place: Mumbai
Date : August 10, 2022

ESSAR SHIPPING LIMITED

Regd. Office: EBTSL Premises, ER-2 Building (Admin Building) Salaya, 44 KM, P.O. Box No.7, Taluka Khambalia, Devbhumi Dwarka, Gujarat - 361305
 E-mail: est.secretarial@essarshipping.co.in • Website: www.essar.com • CIN: L61200GJ2010PLC060285
 Head Office: Essar House, 11, Keshavnagar Khadye Marg, Mahalaxmi, Mumbai - 400 034

STATEMENT OF STANDALONE AND CONSOLIDATED UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 30 JUNE 2022 (₹ in Crore)

Sr. No.	Particulars	Standalone				Consolidated			
		Quarter ended		Year ended		Quarter ended		Year ended	
		30.06.2022 (Un-audited)	31.03.2022 (Un-audited)	30.06.2021 (Un-audited)	31.03.2022 (Audited)	30.06.2022 (Un-audited)	31.03.2022 (Un-audited)	30.06.2021 (Un-audited)	31.03.2022 (Audited)
1	Total income from operations	1.03	74.24	80.38	302.09	24.59	122.91	154.79	553.18
2	Net Profit / (Loss) for the period / year (before tax, exceptional items and extraordinary items)	(47.28)	26.78	(45.40)	(24.57)	(61.57)	17.26	(129.34)	(174.58)
3	Net Profit / (Loss) for the period / year before tax (after exceptional items and/or extraordinary items)	(47.28)	236.35	(512.38)	(249.71)	(15.64)	231.99	(311.27)	(80.77)
4	Net Profit / (Loss) for the period / year after tax (after exceptional items and/or extraordinary items)	(47.28)	236.35	(512.54)	(249.97)	(15.64)	231.99	(311.43)	(81.03)
5	Total comprehensive Profit / (Loss) for the period	-	0.43	-	0.23	-	0.49	-	0.23
6	Paid-up equity share capital (face value of ₹10/- each)	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98	206.98
7	Reserves (Excluding Revaluation Reserve)	-	-	-	(3,503.32)	-	-	-	(5,177.49)
8	Securities Premium Account	3.36	3.36	3.36	3.36	63.51	61.14	60.02	61.14
9	Net Worth	(3,343.63)	(3,296.35)	(3,559.15)	(3,296.35)	(4,698.54)	(4,645.91)	(4,884.95)	(4,645.91)
10	Paid up Debt Capital / Outstanding Debt	2,501.43	2,511.54	3,190.84	2,511.54	3,901.25	3,912.37	4,572.82	3,912.37
11	Outstanding Redeemable Preference Shares	-	-	-	-	-	-	-	-
12	Debt equity ratio (times)	(0.75)	(0.76)	(0.90)	(0.76)	(0.83)	(0.84)	(0.94)	(0.84)
13	Earnings per share (of ₹10/- each) (EPS)								
	(a) Basic (in ₹)	*(2.28)	11.42	*(24.76)	*(12.08)	*(0.76)	10.91	*(15.05)	(3.77)
	(b) Diluted (in ₹)	*(2.28)	11.42	*(24.76)	*(12.08)	*(0.76)	10.91	*(15.05)	(3.77)
14	Capital Redemption Reserve	-	-	-	-	-	-	-	-
15	Debtenture redemption reserve	101.17	101.17	101.17	101.17	101.17	101.17	101.17	101.17
16	Debt service coverage ratio (times)	(0.04)	0.45	0.41	0.29	0.16	0.49	0.17	0.31
17	Interest service coverage ratio (times)	(0.06)	1.65	0.74	1.11	0.27	1.45	0.26	0.81

***Not annualised**
 Note: The above is an extract of the detailed format of Standalone & Consolidated Financial Result for the quarter ended 30 June, 2022 filed with stock exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and consolidated audited Financial Results for the quarter ended 30 June, 2022, are available on the website of the Company, www.essar.com and website of the Exchange (www.bseindia.com and www.nseindia.com)

For Essar Shipping Limited
 Sd/-
Rajesh Desai
 Director

Place: Mumbai
Date: 10 August 2022

PUBLICATION

Notice dated 21.07.2022 in Loan Account No. HLLAAHE00302815 was issued by undersigned on behalf of Indiabulls Commercial Credit Limited, secured creditor, to Sanjaykumar Shah Alias Sanjay Kumar Jashwantal Shah, Rajendra Shah Alias Rajendrabhai Jashwantal Shah, Savitaben Shah Alias Shah Savitaben Jashwantal, Parul Shah Alias Parul Rajendrakumar Shah, Kruti Shah Alias Kruti Sanjay Kumar Shah ("Borrower(s)/Co-Borrower(s)") to provide information to the undersigned regarding other legal heir(s) of Late Mr Jashwantal Shah Alias Jashwantal Shantilal Shah within 4 (Four) days from the date of receipt of the said notice. As the Borrower(s)/Co-Borrower(s) have failed to provide the legal heir details it is hereby assumed by the undersigned that there are no other legal heir(s) of Late Mr Jashwantal Shah Alias Jashwantal Shantilal Shah apart from the above mentioned Borrower(s)/Co-Borrower(s).

Place: AHMEDABAD
For Indiabulls Commercial Credit Ltd
AUTHORISED OFFICER

APPENDIX-IV POSSESSION NOTICE (See Rule 8(1))

Whereas (For immovable property) The undersigned being the Authorised Officer of **CANARA BANK** under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 18.10.2006 calling upon the Borrower **Mr. Dhiman Ramkrishna Mehta** to repay the amount mentioned in the notices being **Rs. 2.46,120/- (Rupees Two Lac Forty Six Thousand One Hundred Twenty Only)** plus Unapplied interest and other expenses due from 01.08.2005, within 60 days from the date of receipt of the said notice.

The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Physical possession of the property described herein below in exercise of powers conferred on him under Sub Section (4) of Section 13 Act read with rule 8 of the Security Interest Enforcement Rules and in compliance of Hon'ble District Magistrate Vadodara order dated 01.12.2021 under section 14 of the said Act on this **5th day of August of the year 2022**.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **CANARA BANK**, Raopura Branch, Vadodara for an amount of **Rs. 14,23,812.70ps. (Rupees Fourteen Lac Twenty Three Thousand Eight Hundred Twelve & Paise Seventy Only)** plus interest and other expenses due from 12.09.2018 thereon.

The borrower's attention is invited to the provisions of sub-section (8) of section 13 of the SARFAESI Act, in respect of time available, to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
 All that part and parcel of the property consisting of Flat No. 301, 3rd Floor, Shree Vatika Complex, FSI 500 Sq.Fts. R.S. No. 854, T.P. Scheme No. 3 F.P. No. 1006, City Survey No. 320, Block No. A-22, & A-23, Bapod, Vadodara, within the Registration Sub District and Dist Vadodara. In the name Shri Dhiman Ramkrishna Mehta. Bounded : East by : Main Road, West by : Flat No. 302, North by : Flat No. 305, South by : Main Road.
Date : 05.08.2022
Place : Vadodara
 Authorised Officer
 Canara Bank

Kalupur Bank The Kalupur Commercial Co-op. Bank Ltd. Ph : 27582020 to 27582026
 SINCE - 1979 Multi State Scheduled Bank Fax : 079-27582033, 27544450

H.O. : "Kalupur Bank Bhavan", Nr. Income Tax Circle, Ashram Road, Ahmedabad-14.

SALE OF PROPERTY THROUGH E-AUCTION
SALE OF ASSETS IN POSSESSION OF BANK UNDER THE SECURITISATION & RECONSTRUCTION OF FINANCIAL ASSETS & ENFORCEMENT OF SECURITY INTEREST ACT 2002 AND SECURITY INTEREST (ENFORCEMENT) RULES-2002.

Offers are invited in sealed cover so as to reach the Authorized Officer on or before 25/08/2022 for the sale of the following property in the possession of the bank on "As is where is basis & whatever there is basis" towards the recovery of its secured debts with interests, costs, charges etc. from borrowers as stated hereunder.

Lot No.	Borrower Name	Secured Debt for Recovery	Description of Properties	Reserve Price Rs.	EMD Rs.
1.	Ashok Satyanarayan Khakholia	As per Sec-13(2) demand notice dtd.13/04/21 Rs.25,48,971/- + Interest & expenses thereon	Owner : Savita Pursotam Agrawal Survey No 50/1-50/2/Block No. 113&114 T.P. No 43,F.P. No. 50 Ashwini Enclave Tower No.1/B, Building No.D 1st Floor, Flat No.d/104, Dist.Surat, Tal. City, Mouje : Bhirmad, Admeasuring about 990 sq.ft, i.e. 91.97Sq.mtrs.Super Builtup Area & 74.22 Sq.Mtrs.Builtup Area Construction thereon.	25,75,000/-	2,57,500/-

Important Dates
 Site visit of property between date 16/08/2022 & time 12.00 P.M. to 4:00 P.M.
 Last date for offer submission of offer date 25/08/2022 & time 4:00 P.M.
 E-Auction Dt.26/08/2022 and time 11:00 A.M. to 2:00 P.M.
 Website of E-Auction selling of property https://sarfaesi.auctiontiger.net
 More details terms of Condition for E-Auction https://sarfaesi.auctiontiger.net
 For further information of E-Auction Contact to Shri Ramprasad on Mo. No.9978591888
 For further information of Property Contact to Shri Jayesh V Sankaliya Mo. No.9429510480
Authorized Officer
The Kalupur Comm. Co-op. Bank Ltd.
H.O. Ahmedabad - 380 014.

Place : Surat
Date : 10/08/2022

ART NIRMAN LTD
 CIN: L45200GJ2011PLC064107

Registered Office:410, JBR Arcade, Science City Road, Sola, Ahmedabad, Gujarat-380060.
(O): 079 27710511/12 **(E):** cs@artnirman.com **(W):** www.artnirman.com

Extract of Unaudited Financial Results for the Quarter ended 30th June, 2022. (in Lacs)

Particular	Quarter ended on 30.06.2022	Year to date Figures on 31.03.2022	Corresponding 3 months quarter ended in the 30.06.2021
Total Income from operation	30.26	3688.66	258.26
Net Profit/Loss for the period (before tax, exceptional items and/or extraordinary items)	(13.07)	(1100.87)	(316.55)
Net Profit/Loss for the period (before tax, after exceptional items and/or extraordinary items)	(13.07)	(1100.87)	(316.55)
Net Profit/Loss for the period (after tax, exceptional items and/or extraordinary items)	(13.07)	(1099.70)	(316.35)
Total comprehensive income for the period (comprising profit/loss for the period after tax and other comprehensive income after tax)	(13.07)	(1099.70)	(316.35)
Paid up Equity Share Capital (face value of INR 10/- each)	2495.6	2495.6	2495.6
Earning per shares			
1. Basic	(0.05)	(4.41)	(1.27)
2. Diluted	(0.05)	(4.41)	(1.27)

Notes:
 1. The above Unaudited financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors in their respective meeting held on 10th August, 2022.
 2. The figures of the previous period/year have been regrouped / recast / reclassified wherever considered necessary to conform to the current year's presentation.
 3. The Company has only one segment i.e "Real Estate". Hence there are no reportable segments under AS-17. During the year under Report, the company has carried out all the business operations in India. The conditions prevailing in India being uniform, no separate geographic disclosure are considered necessary. Hence segment reporting is not required.
 4. The above financials have been prepared in accordance with Indian Accounting Standard as prescribed under Section 133 of the Companies Act, 2013 read with Rule 3 of the companies (IND AS) Rules, 2015 as amended and other recognised accounting practices and policies to the extent applicable.
 5. The above Financial Results are available on Company's website www.artnirman.com as well as on the the stock exchange website viz. www.nseindia.com.

Date: 11.08.2022
Place: Ahmedabad
For ART NIRMAN LTD
 Sd/-
Ashokkumar R. Thakker
 Chairman & Managing Director

